

કેસ દાખલ થયા તારીખ	:	૦૯/૦૫/૨૦૨૫		
કેસ રજી. થયા તારીખ	:	૦૯/૦૫/૨૦૨૫		
કેસ ફેસલ થયા તારીખ	:	૦૭/૦૩/૨૦૨૬		
સમયગાળો	:	વર્ષ	માસ	દિવસ
		૦૦	૦૯	૨૬

બાયડના મહે. એડી. ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ સાહેબશ્રીની અદાલતમાં,
મુ.બાયડ, જી. અરવલ્લી

ફોજદારી કેસ નંબર : ૬૨૯/૨૦૨૫
આંક :-

ફરીયાદી:- દેસાઈ જતીનકુમાર સુંદરભાઈ,
ઉ.વ.આ.-૩૦, ઘંઘો- ખેતી/પશુપાલન
રહે.બોરમઠ,તા.બાયડ,જી.અરવલ્લી.

વિરુદ્ધ

આરોપી:- પરમાર મુકેશભાઈ રતિલાલ,
ઉ.વ.આ.પુખ્ત, ઘંઘો - ખેતી/પશુપાલન
રહે.અલવાગામ,તા.બાયડ,જી.અરવલ્લી.

ગુન્હો :- ધી. નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ મુજબ

ફરીયાદી તરફે વિ. વ.....શ્રી વી.ડી.ચૌધરી
આરોપી તરફે વિ.વ.....શ્રી જે.જે.કોટવાલ

:: હરાવ ::

(૧) ફરિયાદ પક્ષના કેસની ટૂંકમાં હકિકત એવી છે કે, આ કામના ફરીયાદી બોરમઠ ગામે રહે છે અને ખેતી તથા પશુપાલનનો ઇંદો કરે છે. આ કામના આરોપી અલવાગામે રહે છે અને ખેતી કામ કરે છે. આ કામના આરોપી અવાર નવાર ફરીયાદીના ગામ બોરમઠ તથા આ કામના આરોપી તેમના ગામમાં મળતા હોવાથી તથા આરોપી તથા ફરીયાદીના ગામ એકબીજાની નજીક હોવાથી એકબીજા વચ્ચે ઓળખાણ પરિચય થયેલ અને ઘણા સમયથી એકબીજાના પરિચય થવાથી એકબીજા વચ્ચે પારીવારીક સંબંધો કેળવાયેલા. આ કામના આરોપીને જાન્યુઆરી - ૨૦૨૫ માસમાં નાણાંની જરૂરીયા ઉપસ્થિત થતા ફરીયાદીના ઘરે બોરમઠ મુકામે આવેલા અને ફરીયાદીને જણાવેલ કે મારે અંગત કામ માટે મારે રૂ. ૧,૦૦,૦૦૦/- એક લાખ પુરાની હાથ ઉછીના નાણાંની જરૂર હોય હાથ ઉછીના આપો હુ તમોને બે માસમાં નાણાં પરત કરી દઈશ તેવી માંગણી કરેલી જેથી ફરીયાદીએ આ કામના આરોપીની વાતમાં વિશ્વાસ અને ભરોષો રાખી મદદરૂપ થવાના આશયથી ફરીયાદીએ રૂપિયા એક લાખ ફરીયાદીના ઘરે બોરમઠમાં સાંજના સમયે પરીવારની સંયુક્ત બચતમાંથી આ કામના આરોપીને ફરીયાદીએ બોરમઠ મુકામે આવેલા. આ કામના આરોપીનો વાચદો પુરો થતા ફરીયાદીએ આરોપી પાસે નાણાંની ઉઘરાણી કરતા આ કામના આરોપી ફરીયાદીના ઘરે બોરમઠ મુકામે આવેલા અને તેમની અંગત જવાબદારી સ્વીકારી લઈને આરોપીએ તેમની ખાતાવાળી બેંક ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ બેંક લી. શાખા ઘનસુરાનો ખાતા નં. ૧૧૫૦૦૦૫૩૬૪૭૩ નો ચેક નં. ૦૦૧૦૧૭ નો રૂ. ૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ પુરાનો તા. ૧૮/૦૩/૨૦૨૫ નારોજનો ચેક આપેલો અને આ કામના આરોપીએ ફરીયાદીને જણાવેલ કે ચેકમાં જણાવેલ તારીખે બેંકમાં ચેર તમારા ખાતામાં જમા કરાવશો તો હાથ ઉછીની રકમ તમોને મળી જશે.

આ કામના આરોપીએ આપેલ સદર ચેક ફરીયાદીએ આરોપીની સુચના અનુસાર ખાતાવાળી ભારતીય સ્ટેટ બેંક, બાયડ શાખામાં તા. ૧૮/૦૩/૨૦૨૫ ના રોજ મા કરાવેલ જે ચેક આ કામના આરોપીની ખાતાવાળી બેંકમાં કલીયર થવા જતા બેંકના મેમાના કારણ નં. ૧ "ઈંડસ ઈનસફીસીયન્ટ (અપુરતુ ભંડોળ)" ના શેરાથી તા. ૧૮/૦૩/૨૦૨૫ ના રોજ ચેક વગર સ્વીકારે પરત ફરેલ અને બેંકે મેમો આપેલો. આ કામના આરોપીએ કાયદેસરની લેહણી રકમ હાથ ઉછીનાની ચુકવવા માટે આપેલ ચેક અપુરતા ભંડોળના શેરાથી પરત ફરતા ફરીયાદીએ ચેકમાં જણાવેલ નાણાં મળેલ નહીં, આમ, ફરીયાદીને છેતરાયા અંગેનો અહેસાસ

થયેલો અને આ કામના આરોપીએ અમો ફરીયાદીની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલાનું માલુમ પડેલું અને ખુબજ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે. તેથી ફરીયાદીએ વકીલશ્રી મારફતે તા.૨૨/૦૩/૨૦૨૫ નારોજ આર.પી.એ.ડી. દ્વારા નોટીસ મોકલાવેલ જે નોટીસ તા.૨૪/૦૩/૨૦૨૫ નારોજ મળી ગયેલ છતાં નોટીસમાં જણાવેલ સમય મર્યાદામાં ફરીયાદીની પાસેથી લઈ ગયેલ હાથઉછીની રકમ ચુકવી આપેલ નથી કે તેનો કોઈ જવાબ આપેલ નથી. જેથી નામદાર કોર્ટમાં ફરીયાદ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ - ૧૩૮ અને ૧૪૨ ની જોગવાઈ મુજબ કરેલ છે.

- (૨) આ કામે આરોપીને સમન્સ કરતાં સમન્સની બજવણી થતાં તેઓ મુદતે નામદાર કોર્ટ સમક્ષ હાજર થયેલ છે અને આરોપીને બી.એન.એસ.એસ. ૨૦૨૩ ની કલમ-૨૩૦ અન્વયે ફરીયાદીએ રજુ કરેલ ફરીયાદ તથા સાથેના દસ્તાવેજોની નકલો આપવામાં આવેલી. ત્યારબાદ આરોપીનું વટાઉખત અધિનિમયની કલમ-૧૩૮ના ગુન્હા સંબંધે બી.એન.એસ.એસ. ૨૦૨૩ ની કલમ-૨૭૪ અન્વયે આરોપીનું નીવેદન આંક - ૧૦ થી લેતા આરોપીએ ગુનાનો ઈન્કાર કરેલ હોય, ત્યાર બાદ સદરહુ કામ ફરીયાદ પક્ષના પુરાવા માટે રાખવામાં આવેલ છે.
- (૩) આ કામે ફરીયાદ પક્ષ તરફે નીચે મુજબના મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવેલા છે.

મૌખિક પુરાવો :

ક્રમ	સાહેદની વિગત	આંક
૦૧	ફરીયાદી - દેસાઈ જતીનકુમાર સુંદરભાઈ સરતપાસનુ સોગંદનામુ	૦૪

દસ્તાવેજી પુરાવો :

ક્રમ	દસ્તાવેજની વિગત	આંક
૦૧	આરોપીએ ફરીયાદીને આપેલ અસલ ચેક	૧૧
૦૨	અસલ ચેક રીટર્ન મેમા	૧૨
૦૩	આરોપીને વકીલશ્રી મારફતે આપેલ નોટીસની સ્થળપ્રત	૧૩
૦૪	નોટીસ રજી.પો.એડીથી મોકલેલ જે પોષ્ટની સફેદ પાવતી	૧૪
૦૫	આરોપીને નોટીસ મળેલ ઓનલાઈન સ્લીપ	૧૫

(૪) ફરિયાદપક્ષનો પુરાવો રજુ થયા બાદ આરોપી કેસ કાર્યવાહીમાં પોતાનો બચાવ રજુ કરવા માટે હાજર રહેલા નથી. તેમજ ફરીયાદીનું પુરાવાનું સોગંદનામું તથા રજુ તમામ દસ્તાવેજી પુરાવાઓ આરોપીને આપેલા હોવા છતાં તેઓએ આ પુરાવાઓ નો ઈન્કાર કરવા માટે હાજર રહેલા નથી. તેમજ આરોપીને ફરીયાદી ધ્વારા તેઓના વિરુદ્ધમાં જે કોઈ પુરાવો રજુ કરેલ છે, તેની તમામની નકલ આપેલ છે, તે સિવાય વિશેષ કોઈ પુરાવો રજુ થયેલ નથી. વધુમાં આરોપી ધ્વારા નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૪૫(૨) મુજબની કોઈ અરજી આપેલ ન હોઈ, કે તેઓ ફરીયાદી ની ઉલટ તપાસ કરવા માંગે છે તેવી રજૂઆત કરેલ હોય તેવું રેકર્ડ ઉપરથી જણાઈ આવતું નથી. આમ, આરોપી પોતાની સામેના તમામ પુરાવાઓ જાણતો હોવા છતાં તેનો ઈન્કાર કરવા કે પોતાનો બચાવ રજુ કરવા માટે હાજર રહેલા નથી. ત્યારે હાલના આરોપીએ તેઓની સામેના આક્ષેપમાં થી પ્રથમથી જ કોઈ બચાવ રજુ કરેલા ના હોય અને જ્યારે એક વખત આરોપીને પોતાની સામે કેસ ચાલે છે તેની જાણ છે, ત્યારે તેની અદાલત સમક્ષ હાજર થવાની ફરજ છે. તેમની સામેના પુરાવાનો ખુલાસો કરવા પુરતી તક આપેલ હોવા છતાં આરોપી હાજર રહેલ ન હોય, જેથી બી.એન.એસ.એસ. ૨૦૨૩ ની કલમ-૩૫૧(૧)(બી) નો પરંતુક ધ્યાને લેતા, તેઓના વધારા નિવેદનનો હકક બંધ કરવામાં આવેલ. ત્યારબાદ સદર કામ દલીલ માટે મુલતવી રાખવા માં આવેલ.

(૫) ફરીયાદી તરફે તેઓની મૌખિક દલીલમાં ફરીયાદીએ તેઓનો કેસ પુરવાર કરેલ હોવાનું તેમજ તેના સમર્થનમાં આપેલ પુરાવાનું સોગંદનામા અન્વયે આરોપી ધ્વારા ઉલટ-તપાસ કરવામાં આવેલ ન હોય, તથા ઉલટ તપાસનો હકક બંધ થયા બાદ હકક ખોલવાની કોઈ અરજી આપેલ ન હોય, તેવા સંજોગોમાં આરોપીને પુરતી તક આપેલ હોવા છતાં આરોપીએ પોતાનો બચાવ રજુ કરેલ ન હોય અને ફરીયાદ પક્ષે પોતાનો કેસ પુરવાર કરેલ હોય તથા આરોપી ધ્વારા આ કામે તેઓના બચાવમાં કોઈ સાક્ષી કે પુરાવાઓ રજુ કરેલ નથી કે જાતે વીટનેસ બોક્સમાં આવીને જુબાની આપેલ ન હોય, તેમજ રજુ રાખેલ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લેતાં આરોપી સાથે વ્યવહાર કરેલ હોવાનું અને તેના લેણા પેટે વાદગ્રસ્ત ચેક આપેલ હોવાનું ફરીયાદી પુરવાર કરતા હોય, જેથી ફરીયાદ પક્ષે પોતાના કેસ પુરવાર કરેલ હોય, તેમજ આરોપી તરફે કોઈ સાક્ષી તપાસેલ ન હોય, તેવા સંજોગોમાં આરોપી વિરુદ્ધનો ગુનો પુરવાર થતો હોય, કાયદામાં ઠરાવેલ મહત્તમ સજા કરવા રજૂઆત કરેલ છે. આરોપીએ આ કામે હાજર રહી કોઈ દલીલ કે રજૂઆત કરેલ નથી.

(૬) ફરીયાદ હકીકત,રેકર્ડમાં રજુ તમામ મૌખિક તથા દસ્તાવેજી પુરાવા તથા કાયદાકીય જોગવાઈઓ ધ્યાનમાં લેતાં, ફરીયાદપક્ષના કેસના આખરી નિર્ણય અર્થે નીચે મુજબના મુદાઓ ઉપસ્થિત થાય છે.

-: મુદાઓ :-

૧. શું ફરીયાદ પક્ષ નિ:શંકપણે પુરવાર કરે છે કે, આ કામના ફરીયાદી તથા આરોપી વચ્ચેના કેસ બાબતે તમો આરોપીએ ફરીયાદીના ઘરે બોરમઠ મુકામે આવી તા. ૧૮/૦૩/૨૦૨૫ નાર રોજનો ચેક નં-૦૦૧૦૧૭ નો રકમ રૂ.૧,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા એક લાખ પુરા) નો ધી સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક, ઘનસુરા શાખાનો તેમાં આરોપીએ ચેક ભરી ભરાવી ને આપેલ. જે ચેક ફરીયાદી એ તેમના ખાતાવાળી બેંકમાં ભરતા જે ચેક પરત ફરેલ જે ચેક ભરતા સદર ઉપરોક્ત જણાવેલ ચેક સ્વીકારાયા વિના " ઇન્ડસ ઈનસફીસીયન્ટ " શેરાથી પરત ફરેલ, તેથી તમો આરોપી ને રજી. એ.ડી.થી નોટીસ આપેલ જે નોટીસ આરોપીનાઓએ સ્વીકારી નોટીસનો જવાબ નહી આપી તેમજ લેણા નીકળતા નાણાં નહી આપી, તમો આરોપીએ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ અને ૧૪૨ મુજબનો શિક્ષાપાત્ર ગુનો કરેલ છે ?

(૨) શું હુકમ ?

(૮) ઉપરોક્ત મુદાના મારા જવાબો નીચે મુજબ છે.

(૧) હકારમાં.

(૨) આખરી હુકમ મુજબ.

:: કારણો ::

મુદા નં. ૧ :-

(૯) સદર કામમાં કેસના ગુણદોષો નક્કી કરતા અગાઉ સદરહું કાયદા અંગે સ્પષ્ટીકરણ જરૂરી જણાવુ હોય સદરહું કામમાં જે ગુના સબબ હાલની ફરીયાદ દાખલ થયેલ હોય તેની કાયદાકીય જોગવાઈ લક્ષમાં રાખીએ તો ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૧૮ મુજબ :- ફરીયાદ વાળો ચેક એથી વિરુદ્ધનુ સાબીત ન થાય ત્યાં સુધી તે (અ) અવેજ વિશે, (બ) તારીખ વિશે, (ક) સ્વીકારના સમય અંગે, (ડ) તબદીલીના સમય અંગે, (ઈ) શેરાઓના ક્રમ વિશે, (ફ) સ્ટેમ્પ વિશે, (ગ) ધારક યથાક્રમ ધારક છે એમ માની લેવા વિશે, અનુમાન કરવાનું છે. **પુરાવા બોજા**

વિશે એ પ્રસ્થાપીત હકીકત છે કે , ચેક એ વિનિમયપત્ર છે અને વિનિમયપત્ર અન્વયે ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૧૮ મુજબ જો વિરૂઢધનુ પુરવાર કરવામાં ન આવે તો અવેજ, તારીખ, સ્વીકારવાનો સમય, તબદીલીનો સમય, શેરાઓના ક્રમ, ગુમ થયેલ વિનિમયપત્ર ઉપર લગાડેલી પુરતી ટીકીટો સંબંધે અને તેનો ધારણકર્તા કાયદેસરનો ક્રમિક ધારણકર્તા હોવા અંગે કાનુની અનુમાન ધારણા કરી લેવામાં આવશે.તેવી જ રીતે નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ - ૧૩૯ વંચાણે લેતા તેમાં પણ " જ્યાં સુધી વિપરીત પુરવાર કરવામાં ન આવે ,ત્યા સુધી એવું અનુમાન કરવામાં આવશે કે ,ચેકના ધારકે કલમ - ૧૩૮માં જણાવેલ ચેક, કોઈ દેવું અથવા અન્ય જવાબદારીને પુરેપુરી રીતે અથવા અંશતઃ જવાબદારી હતો " આમ,કલમ-૧૩૯ની જોગવાઈઓ જોતા ધારકની તરફેણમાં અનુમાન કરવાની જોગવાઈ સદર કલમમાં કરવામાં આવેલ હોવાનું ફલીત થાય છે. તેવી જ રીતે ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૨૦ મુજબ જો કોઈ વ્યકિત વિનમયપત્ર ઉપર સહી કરી અન્યને આપે અને તે સંપૂર્ણ ક્રોસ હોય કે અપૂર્ણ વિગતવાળો હોય તો તેવી આપનાર વ્યકિત પ્રમથ દર્શનીય રીતે અન્ય વ્યકિતને એવી સતા હસ્તાતંર કરે છે કે , તેમાંની અપૂર્ણ વિગત અથવા અન્ય જરૂરી વિગતો અથવા અન્ય જરૂરી ભરવાની વિગત તેણે સંપૂર્ણ કરી લઈ વિનિમયપત્ર ઉપયોગમાં લેવાનો છે.આમ,ઉપરોક્ત નોંઢેલ કલમ-૧૧૮ ,૧૩૯ અને ૨૦ અન્વયે ઉપલબ્ધ કાનુની અનુમાન અને ધારણા હાથ ઉપરના કેસમાં , ફરીયાદી વિનિમયપત્રનો ધારણકર્તા હોવાનુ માનવાને સભળ કારણ રહે છે. એ ખરુ છે કે, કાનુની અનુમાન અને ધારણા ખંડનીય પ્રકારની છે , અને જો વિરૂઢધનુ પુરવાર કરવામાં આવે તો તેનું કાનુની મુલ્ય રહેતુ નથી.આમ વિરૂઢધની હકીકત સાબીત ન થાય ત્યા સુધી એવુ અનુમાન કરવામા આવશે તે ચેક ધારણ કરનારે તે ચેક કલમ -૧૩૮ માં દર્શાવ્યા મુજબ તેના કોઈ દેવાના અથવા અન્ય જવાબદારીના પુરેપુરા અથવા તેના કોઈ ભાગમાંથી બોજમુકત થવાના બદલામાં તે ચેક મેળવ્યો હશે. વણચુકવ્યો પરત થયેલો ચેક હાલનું કાયદેસરનું દેવુ કે જવાબદારી અદા કરવા માટે આપવામાં આવેલ હતો તેવુ અનુમાન કરવામાં આવશે.આનાથી વિરૂઢધ પુરવાર કરવાનો બોજો યાને કે પરત આવેલ વણ ચુકવ્યા ચેક કાયદેસરની જવાબદારી કે દેવા પેટે ન હતો તેમ પુરવાર કરવાનો બોજો તે ચેક લખી આપનાર પર રહે છે. આમ કલમ ૧૧૮(એ) અને ૧૩૯ ના અનુમાનો એ કાયદાના અનુમાનો છે ચોક્કસ અનુમાનો છે અને આરોપી તરફથી જ્યાં સુધી વિરૂઢધ નું પુરવાર ન થાય ત્યા સુધી તે ખંડીત થતા નથી. આ કામે સર્વોચ્ચ અદાલત ઘવારા

એ સિદ્ધાંત પ્રસ્થાપિત કરવામાં આવેલ છે કે આરોપીએ જેવો શંકાથી પર ચુસ્ત પુરાવો આપવા માટે આરોપીએ સાક્ષીના પાંજરામાં પણ આવવાની જરૂર રહેતી નથી. એટલે કે અનુમાનનું પંડન આરોપી, ફરીયાદપક્ષે જે પુરાવો રજૂ કરેલો છે તેના ધ્વારા પણ તે કરી શકે છે અને આરોપી ધ્વારા માત્ર શંકા ઉત્પન્ન કરતો કે શક્ય પુરાવો આપવો જ જરૂરી છે.

(૧૦) હાલના કેસની ઈન્સાફી કાર્યવાહી ધી.નેગો.ઈ.એક્ટની કલમ:૧૩૮ અન્વયે સજાને પાત્ર ગુન્હાહિત કૃત્ય અંગે ચલાવવામાં આવી છે. સદર કલમ અંગેનો સૌપ્રથમ આવશ્યક તત્વ એ છે કે, વાદગ્રસ્ત ચેક કાયદેસરનું દેવું કે જવાબદારી પુરેપુરી કે અંશતઃ અદા કરવા માટે આપવામા આવ્યો હોવો જોઈએ. જે હકિકત પુરવાર કરવા અંગે સાબિતીનો પ્રારંભિક બોજો ફરીયાદી ઉપર હોય છે જે બોજાનું ફરીયાદી વહન કરે કે તુરંતજ ધી નેગો.ઈ.એક્ટની કલમ:૧૩૮ અન્વયે ચેક ધારણ કરનાર યાને કે હાલના ફરીયાદીની તરફેણમાં તેમજ ચેક ડ્રો કરનાર યાને કે હાલના આરોપીની વિરુદ્ધમાં સ્ટેચ્યુટરી અનુમાન કરવાનું રહે છે જે અનુસાર વાદગ્રસ્ત ચેક કાયદેસરના દેવા કે જવાબદારીની સંપૂર્ણતઃ અથવા તો અંશતઃ ચુકવણી કરવા માટે આપવામાં આવ્યો હોવાનું અનુમાન કરવાનું રહે છે. સદર અનુમાન કાયદાકીય અનુમાન છે અને જે પંડનાત્મક અનુમાન છે. પંડનાત્મક પુરાવો રજૂ કરવાનો સંપૂર્ણ બોજો આરોપીની ઉપર રહે છે. સદર પંડનાત્મક પુરાવો રજૂ કરવા માટે કોઈ સીધો કે પ્રત્યક્ષ પુરાવો હોવો જ જોઈએ તેવું જરૂરી નથી. આરોપી કેસના રેકર્ડ ઉપર એવા સંજોગોથી પ્રસ્થાપિત કરી શકે કે જેનાથી વાદગ્રસ્ત ચેક કોઈ કાયદેસરના દેવા માટે આવ્યો જ ન હોવાની સંભાવના ઘણી જ પ્રબળ હોય તો તેનાથી પણ સદર અનુમાનનું પંડન થયાનું ગણી શકાય.

(૧૧) ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ-૧૮૮૧ની કલમ-૧૩૮ નો ગુનો જોઈએ તો તેના તત્વો નીચે મુજબ છે.

૧: કોઈ કાયદેસરના દેવા કે અન્ય જવાબદારી અદા કરવા માટે ચેક આપવામાં આવેલો હોવો જોઈએ. ૨: ચેકના લખનાર વ્યક્તિના ખાતામાં અપુરતા નાણા ભંડોળના કારણે જ ચેકનો અનાદર થયેલ હોવો જોઈએ. ૩: ચેક લખ્યા તારીખથી છ માસની સમયમર્યાદામાં કલીયર થવા માટે બેન્કમાં રજૂ થયેલ હોવો જોઈએ. ૪: ચેકનો અનાદર થયાબાદ બેન્ક તરફથી માહિતી મળ્યાના ૧૫ દિવસની અંદર(હવે સુધારો થયા બાદ ૩૦ દિવસની અંદર) ચેક લખનારને લેખિત ડીમાન્ડ નોટીસ આપીને ચેકમાંની રકમની માગણી કરેલી હોવી જોઈએ.

પ: નોટીસ મળ્યાના ૧૫ દિવસમાં આરોપી ચેકની રકમ ચૂકવણી કરવામાં નિષ્ફળ ગયેલ હોવો જોઈએ. ડ: દેવુ કે જવાબદારી કાયદેસર રીતે અમલ કરાવી શકાય તેવી હોવી જોઈએ.

આમ, ઉપરોક્ત તમામ તત્વો સાબિત કરવામાં ફરીયાદ પક્ષ સફળ થાય તો જ આરોપીને ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ-૧૮૮૧ ની કલમ-૧૩૮ અન્વયેના ગુન્હા સબબ દોષિત ઠરાવી શકાય. આવી જ રીતે ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ-૧૮૮૧ની કલમ-૧૩૮ ચેકના ધારણકર્તાની તરફેણમાં અનુમાન કરવા બાબત છે એટલે કે વિરુદ્ધની હકિકત સાબિત ન થાય ત્યાં સુધી એવું અનુમાન કરવામાં આવે છે કે, તે ચેક ધારણ કરનારે તે ચેક કલમ- ૧૩૮ માં દર્શાવ્યા મુજબ તેના કોઈ દેવા કે અન્ય જવાબદારીના પુરેપુરા અથવા તેના કોઈ ભાગમાંથી બોજામુક્ત થવા બદલ તે ચેક મેળવ્યો હશે અને આ વણચૂકવાયેલ પરત થયેલ ચેક હાલના કાયદેસરના દેવા અથવા જવાબદારી અદા કરવા સારુ જ આપવામાં આવેલ હતો તેવું અનુમાન કરવામાં આવશે. આમ, આ કામે આંક-૧૧ નો ચેક કાયદેસરના દેવા કે જવાબદારી બદલ બોજામાંથી મુક્ત થવા માટે આરોપીએ ફરીયાદીને આપેલ છે અને આ દેવુ કે જવાબદારી કાયદેસરની છે. અને તેનો કાયદા ધ્વારા અમલ કરાવી શકાય તેવો છે. તેવું કલમ-૧૩૮ અન્વયે આ અદાલત અનુમાન કરશે. આનાથી વિરુદ્ધનું પુરવાર કરવાનો બોજો ચાને કે પરત આવેલ આંક-૧૧ નો ચેક વણચૂકવ્યા ચેકની વર્તમાનની ચાને હાલનો કાયદેસરની જવાબદારી કે દેવા પેટે ન હતો અથવા તો તે ચેક બિનઅવેજી હતો તેમ પુરવાર કરવાનો બોજો તે ચેક લખી આપનાર ઉપર રહે છે. આ કામે હાલના આરોપી ઉપર આ બોજો રહે છે.

આમ, કલમ-૧૧૮ અને ૧૩૮ની કાનૂની જોગવાઈઓ જોઈએ તો કોર્ટ હંમેશાં ફરીયાદીની તરફેણમાં અનુમાન કરવા બંધાયેલ છે, અદાલત ફરીયાદીની તરફેણમાં કલમ-૧૧૮ અને ૧૩૮ મુજબ અનુમાન ન કરે તે માટે વિરુદ્ધનું પુરવાર કરવાનો બોજો કાયદા ધ્વારા આરોપી ઉપર નાખવામાં આવેલ છે. પરંતુ કલમ-૧૧૮ અને કલમ-૧૩૮ અન્વયે આ કોર્ટ હાલના આરોપી વિરુદ્ધ ત્યારે જ ઉપર કહ્યા મુજબ અનુમાન કરી શકે છે કે જ્યારે ફરીયાદીની ફરીયાદ કલમ-૧૩૮ અને કલમ-૧૪૨ અન્વયે સમય મર્યાદામાં જ દાખલ કરવામાં આવેલી હોવી જોઈએ અને આ બે કલમોમાં જણાવેલ આદેશાત્મક જોગવાઈઓનું ફરીયાદ પક્ષે નિ:શંકપણે પાલન કરેલ હોવું જોઈએ.

(૧૨) આ કામમા ફરીયાદપક્ષ તરફથી રજુ થયેલ પુરાવો જોઈએ તો આ કામે ફરીયાદપક્ષ તરફથી ફરીયાદીએ આંક-૦૪ થી ફરીયાદી - દેસાઈ જતીન સુંદરભાઈનાઓએ સોગંધનામાં ઉપર લેખીત સર તપાસ રજુ કરેલ છે. જેમાં તેઓએ તેમની આંક-૧ ની અરજીમાં જણાવેલ હકીકતો મુજબની હકીકતો તેમની સરતપાસમાં જણાવતાં હોય, જેથી પુનરાવર્તનનો દોષ ટાળવા સારુ સદર સરતપાસની ચર્ચા અત્રે કરવામાં આવતી નથી. ફરીયાદ પક્ષે આંક- ૧૧ થી આંક - ૧૫ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ છે.

આ કામના આરોપીને ફરીયાદીની ઉલટતપાસ માટે પુરતી તક આપવામાં આવેલ.પરંતુ આરોપી હાજર ન રહેતા અને ફરીયાદી તરફે કરેલી રજુઆત અને રેકર્ડ પરના આરોપીનુ વર્તન લક્ષમાં રાખીને ફરીયાદીની ઉલટતપાસનો આરોપીનો હકક બંધ કરવાનો હુકમ કરી આરોપીનો ફરીયાદીની ઉલટતપાસ કરવાનો હકક બંધ કરવાનો હુકમ કરવામા આવેલ છે. આમ, સદર કામમાં અત્રેની કોર્ટનું નક્કપણે માનવુ છે કે, સદર કામમાં ફરીયાદીએ આંક-૦૪ થી સરતપાસનો પુરાવો આપેલ છે અને તેઓ ધ્વારા આંક-૧૧ વાળો તકરારી ચેક ફરીયાદીએ પોતાના ખાતામાં નાંખેલ હોવાની અને આંક-૧૨ વાળા રીટર્ન મેમોથી પરત થયેલ હોવાની હકીકત જણાવેલ છે. ત્યારબાદ નિયમઅનુસાર સમય મર્યાદાની અંદર આંક-૧૩ થી ડીમાન્ડ નોટીસ આરોપીને આપવામાં આવેલી. જે નોટીસ આરોપીને બજી ગયેલી ત્યારબાદ આરોપીએ નિયત સમયમા ફરીયાદીને ચેકની રકમ ચુકવી આપેલ ન હતી જેથી સદરહું ફરીયાદ આરોપી ધ્વારા અત્રેની કોર્ટમાં નિયમઅનુસાર દાખલ કરવામાં આવેલી. આમ સદરહું ફરીયાદીએ જે ફરીયાદ નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ અન્વયે દાખલ કરેલ છે તેમાં સદરહું કાયદાના તમામ પ્રાવધાનો પુર્ણ કરવામાં આવેલ છે ત્યારે ફરીયાદીની તરફેલામાં સદરહું કાયદાની કલમ-૧૧૮ તથા ૧૩૯ નું અનુમાન ઉત્પન્ન થવા પામેલ છે. આમ, સદર દસ્તાવેજી પુરાવાઓ નુ અવલોકન કરતા તે સ્પષ્ટ થઈ જાય છે કે, આરોપીને સદર ચેકો પરત ફર્યા બાબતની લીગલ નોટીસ આપવામાં આવેલ છે. જે લીગલ નોટીસ અન્વયે આરોપીએ કોઈ વાંધો કે તકરાર લેખિતમાં લીધેલ નથી. આ કામે વાદવાળા ચેકોમાં પોતાની સહી નથી કે પોતે કાયદેસરના લેણા પેટે આ ચેકો આપેલો નથી તેવું પણ આરોપીનું કથન નથી. આમ, નોટીસ બાદ આરોપીએ નાણા ચુકવેલ ન હોય, જેથી હાલની ફરીયાદ કરેલ હોવાનુ જણાવેલ છે. આમ, ફરીયાદી ધ્વારા નેગો. ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ- ૧૩૮ મુજબની તમામ પ્રક્રિયા કરેલ હોવાનુ ફલિત થાય છે. આરોપી

ધ્વારા ફરીયાદીની ઉલટ તપાસ કરવામાં આવેલ હોય તેવું રેકર્ડ પરથી જણાય આવતું નથી. આરોપી ધ્વારા ફરીયાદીની ઉલટ તપાસ કરવા હાજર રહેલ ન હોય, ઉલટ તપાસનો હકક બંધ કરવામાં આવેલ હોવાનું રેકર્ડ પરથી ફલિત થાય છે. આમ, ફરીયાદીનું પુરાવાનું સોગંદનામું વંચાણે લેવામાં આવે તો ફરીયાદી એ તેમા જણાવેલ હકીકતો તેમની ફરીયાદને મદદરૂપ થતી હોવાનું તથા આરોપી ધ્વારા આપવામાં આવેલ ચેક રીટર્ન થયેલ તેમજ તેઅંગેની કાયદેસરની નોટીસ આપતા, નોટીસ મુજબના નાણાં આરોપીએ ચુકવેલ ન હોય, જેથી હાલની ફરીયાદ કરેલ હોવાનું પુરવાર કરેલ છે. ફરીયાદીની ફરીયાદ તથા પુરાવાનું સોગંદનામું વંચાણે લેતા ફરીયાદીએ આરોપી સામેનો કેસ પુરવાર કરેલ હોવાનું ફલિત થાય છે.

(૧૩) આ કામે કાયદાકીય જોગવાઈ તથા નામ.સુપ્રિમકોર્ટ ધ્વારા આપવામાં આવેલ ચુકાદાને વંચાણે લેવામાં આવે તો, નામ. સુપ્રિમ કોર્ટ ધ્વારા Mallavarapu Kasivisweswara Rao v. Thadikonda Ramulu Firm & Ors. માં નીચે મુજબ ઠરાવેલ છે.

"Under Section 118(a) of the Negotiable Instruments Act, the court is obliged to presume, until the contrary is proved, that the promissory note was made for consideration. It is also a settled position that the initial burden in this regard lies on the defendant to prove the non-existence of consideration by bringing on record such facts and circumstances which would lead the Court to believe the non-existence of the consideration either by direct evidence or by preponderance of probabilities showing that the existence of consideration was improbable, doubtful or illegal. ..."

ઉપરોક્ત ચુકાદાને વંચાણે લેવામાં આવે તો નામદાર સુપ્રિમ કોર્ટ ધ્વારા કલમ - ૧૧૮ એ અંગે ની ચર્ચા કરેલ છે અને ઠરાવેલ છે કે, આરોપી ધ્વારા એ સાબિત કરવાનું રહે છે કે, જે વ્યવહાર થયેલ છે તેનું કોઈ અસ્તિત્વ નથી તથા તે અંગેનો પુરાવો રજૂ કરવાનો રહે અથવા તો, જે કંઈ પુરાવો ફરીયાદપક્ષે રજૂ કરવામાં આવે તે પુરાવા પરથી જો કોઈ શંકા ઉપસ્થિત થતી હોય તો, તે શંકા બાદ જો આરોપી પુરવાર કરે કે કહેવાતું કોઈ લેણું ફરીયાદી મેળવવા હકકદાર નથી તો ત્યારબાદ ફરીયાદીએ આવું લેણું હવે કે કેમ તે પુરવાર કરવાનું રહે છે. તે સિવાય કલમ ૧૧૮(એ) મુજબ વિરુદ્ધનું સાબિત ન થાય ત્યાં સુધી એવું માની લેવાનું રહે છે કે, ચેક અવેજ માટે આપવામાં આવેલ અને તેમાં જ્યારે પણ સહી કરવામાં આવેલ ત્યારે તે પુરતા અવેજ સાથે સ્વીકારવામાં આવેલ. હાલના કિસ્સામાં પણ આરોપી ધ્વારા તેવો કોઈ પુરાવો રજૂ કરેલ નથી જેનાથી વાદગ્રસ્ત ચેક તેઓએ ફરીયાદીને કોઈ અવેજ વગર આપેલ હોય, અથવા તો ફરીયાદીએ કોઈ અન્ય

રીતે વાદગ્રસ્ત ચેક મેળવીને તેનો દુરપયોગ કરેલ હોય, જેથી વાદગ્રસ્ત ચેક જે તે સમયે કાયદેસરના લેણા માટે આપેલ હોવાનું પુરવાર થાય છે.

(૧૪) ફરીયાદી ધ્વારા નામદાર સુપ્રિમકોર્ટ ધ્વારા આપવામાં આવેલ ચુકાદા પર આધાર રાખેલ છે જે વંચાણે લેવામાં આવે તો, નામદાર સુપ્રિમ કોર્ટ ધ્વારા Rangappa vs Sri Mohan on 7 May, 2010 Criminal Appeal No. 1020 OF 2010 માં નીચે મુજબ ઠરાવેલ છે.

22. Because both section 138 and 139 require that the Court 'shall presume' the liability of the drawer of the cheques for the amounts for which the cheques are drawn, ..., it is obligatory on the Court to raise this presumption in every case where the factual basis for the raising of the presumption has been established. It introduces an exception to the general rule as to the burden of proof in criminal cases and shifts the onus on to the accused (...). Such a presumption is a presumption of law, as distinguished from a presumption of fact which describes provisions by which the court may presume a certain state of affairs. Presumptions are rules of evidence and do not conflict with the presumption of innocence, because by the latter all that is meant is that the prosecution is obliged to prove the case against the accused beyond reasonable doubt. The obligation on the prosecution may be discharged with the help of presumptions of law or fact unless the accused adduces evidence showing the reasonable probability of the non-existence of the presumed fact.

ઉપરોક્ત ચુકાદાને વંચાણે લેવામાં આવે તો નામદાર સુપ્રિમ કોર્ટ ધ્વારા કલમ-૧૩૮ તથા ૧૩૯ અંગેની ચર્ચા કરેલ છે. અને ઠરાવેલ છે કે, નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ જ્યારે આરોપી ધ્વારા ફરીયાદીને ચેક આપવામાં આવેલ અને તે ચેક બેંકમાં જમા કરાવ્યેથી જો તે રીટર્ન થાય તો, તે અંગેની જાણ થયેથી ફરીયાદી ધ્વારા આરોપીને નોટીસ આપવાની રહે છે. તે નોટીસ મળેથી જો આરોપી નોટીસ નો અમલ ન કરે તો, ફરીયાદી તે અંગેની ફરીયાદ નેગો. ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ મુજબ દાખલ કરી શકે છે અને કલમ-૧૩૯ મુજબ વિરુદ્ધન અનુમાન સાબિત કરવાની જવાબદારી આરોપીની રહે છે અને ફરીયાદી ધ્વારા રજુ રાખવામાં આવેલ પુરાવા તથા જરૂર પડયેથી આરોપી પોતાના પુરાવા રજુ રાખીને જો એવું પુરવાર કરે કે, ચેકમાં દર્શાવેલ રકમ મુજબનું ફરીયાદીનું કાયદેસરનું લેણું ન હતું અથવા તો ફરીયાદી ચેકમાં દર્શાવેલ રકમ કાયદેસર રીતે, મેળવવા હકકદાર નથી તો ત્યારબાદ તે પુરવાર કરવાની જવાબદારી ફરીયાદી પર શીફ્ટ થાય છે. હાલના કેસમાં આરોપી ધ્વારા એવો કોઈ પુરાવો આપેલ નથી કે, ફરીયાદીનું કાયદેસરનું કોઈ લેણું નથી. ફરીયાદી ધ્વારા આરોપીએ આપેલ ચેકો બેંકમાં જમા કરાવતા પરત

થયેલ હોવાનું તથા તે ચેક પરત થવાનું કારણ તથા આરોપી ને નોટીસ આપેલ હોવાનું પુસ્તક કરેલ છે. તેવા સંજોગોમાં ફરીયાદી દ્વારા આરોપી વિરુદ્ધ નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ – ૧૩૮ મુજબનો ગુનો પુસ્તક કરેલ હોવાનું ફલિત થાય છે.

(૧૪) જ્યારે એક વખત આરોપીને પોતાની સામે કેસ ચાલે છે તેની જાણ છે ત્યારે આરોપીની અદાલત સમક્ષ હાજર થવાની ફરજ છે. તેમની સામેના પુરાવા નો ખુલાસો કરવા પુસ્તકી તક આપેલ હોવા છતાં આરોપી હાજર રહેલ ન હોય, તેવા સંજોગોમાં આરોપી કેસની કાર્યવાહી થી છટકવા અથવા જાણી જોઈ ને પોતે પોતાની સામેના કેસની કાર્યવાહીથી બચવા છુપાતો ફરતો હોય ત્યારે આરોપીની ગેરહાજરી પણ કેસ ચાલી શકે છે તેમજ બી.એન.એસ.એસ. ૨૦૨૩ ની કલમ-૩૯૨(૬) માં કરવામાં આવેલ જોગવાઈ મુજબ અદાલત આરોપીની ગેર હાજરીમાં ચુકાદો જાહેર કરી શકે છે. Be You Ever So High, But The Law Is Above You, કાયદાથી પર કોઈ નથી. આરોપીને બચાવની તક આપવી જોઈએ અને આ જોગવાઈ તેને રક્ષણાત્મક જોગવાઈ તરીકે આપવામાં આવેલ છે. પરંતુ આરોપી ખાસ કરીને નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ- ૧૩૮ મુજબના ગુનામાં તેનો હથિયાર તરીકે ઉપયોગ કરી કાયદાકીય પ્રક્રિયાને નિષ્ક્રીય અથવા તો શિથિલ બનાવવાનો પ્રયત્ન કરે છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા Sharad Jethalal Savla vs State of Gujarat Cr. Mic. App.19862 of 2015 Dt. 14/11/2016 માં નીચે મુજબ ઠરાવેલ છે.

Para 16 : " if a person accused of an offence and convicted as such avoids arrest and avoids imprisonment as sentenced by the criminal court. Such an incident only makes the justice delivery system insignificant and renders justice ineffective. Legal justice requires that an offender convicted of a crime must suffer the imprisonment as otherwise there would be social anarchy. People would contravene the law with impunity without any attending punishment for violating the law. The very foundations of democracy and rule of law would be shaken and that is the reason why the Courts strive to treat all persons before the criminal law as equal. Whether one is rich or poor, whether one is in powerful or powerless, the criminal law is equally applied to all equally.

Para 17 : " Be you ever so high, but the law is above you', is the signature theme of rule of law that loudly and silently (as well) echoes in the Indian Constitutional context. The purpose of the Constitution itself is to equalize the men (and women) before the law. Equal protection of laws and equality before the law does not make any distinction between the Ruler and the ruled when it comes to enforcing the criminal sanctions. If a convict with money power as well as political power can avoid the punishment imposed by the highest

Court of the State, the Court which imposed such punishment cannot be a mute spectator or dumb listener to be soothed by high caliber forensic oratory of the counsel at the altar of justice. The Court must and ought to take a serious view of such bizarre incidence: be it one in million. Of course, the law makers and law enforcers must willingly assist the Court in angling the convict avoiding and dodging the law makers, the law enforcers and the law interpreters (Judges and Courts).

ઉપરોક્ત ચુકાદાને વંચાણે લેવામાં આવે તો નામદાર ગુજરાત હાઈકોર્ટ ધ્વારા ઠરાવેલ છે કે આરોપીને પોતાની સામે કેસ ચાલે છે તેની જાણ છે ત્યારે આરોપી ની અદાલત સમક્ષ હાજર થવાની ફરજ છે. તેમની સામેના પુરાવાનો ખુલાસો કરવા પુરતી તક આપેલ હોવા છતાં આરોપી હાજર રહેલ ન હોય, તેવા સંજોગોમાં આરોપી કેસની કાર્યવાહીથી છટકવા અથવા જાણી જોઈને પોતે પોતાની સામેના કેસની કાર્યવાહીથી બચવા છુપાતો ફરતો હોય ત્યારે આરોપીની ગેરહાજરી પણ કેસ ચાલી શકે છે.

(૧૫) નામદાર ગુજરાત હાઈ કોર્ટ ધ્વારા Special Criminal Application no.4194/ 2014, Mukeshbhai Ishwarbhai Prajapati Vs. State of Gujarat ના ચુકાદામાં નીચે મુજબ ઠરાવેલ છે. Yet again in a recent pronouncement of the Supreme Court of India of Indian banks Association and Others and union of India and others (2014) 5 SCC 590, the Supreme Court reiterated the position of law explaining that under section 145 of the Act, the complainant can give his evidence by way of an affidavit and such affidavit shall be read in evidence in any inquiry trial and other proceeding in the Court, which makes it clear that complainant is not required to examine himself twice i.e. one after filing the complaint and one after summoning of the accused. The court further explained that the affidavit and the documents filed by the complainant along with the complaint for summon in stage and the pose summoning stage. In other words, there is no necessity to recall and re-examine the complainant after summoning the accused, unless the Magistrate passes a specific order as to why the complainant is to be recalled. such an order is to be passes on an application made by the accused or under section 145(2) of the Act suo-motu by th court.

(૧૬) બી.એન.એસ.એસ. ૨૦૨૩ માં કરવામાં આવેલ જોગવાઈ વંચાણે લેતાં નીચે મુજબની જોગવાઈ કરવામાં આવેલ છે.

Section 392. Judgment

(7) No judgment delivered by any Criminal Court shall be deemed to be invalid by reason only of the absence of any party or his pleader on the day or from the place notified for the delivery there of, or of any omission to serve, or defect in serving, on the parties or their pleaders, or any of them, the notice of such day and place.

Section 458. Execution of sentence of imprisonment

- (1) Where the accused is sentenced to imprisonment for life or to imprisonment for a term in cases other than those provided for by section 413, the Court passing the sentence shall forthwith forward a warrant to the jail or other place in which he is, or is to be, confined, and, unless the accused is already confined in such jail or other place, shall forward him to such jail or other place, with the warrant :

Provided that where the accused is sentenced to imprisonment till the rising of the Court, it shall not be necessary to prepare or forward a warrant to a jail, and the accused may be confined in such place as the Court may direct.

- (2) Where the accused is not present in Court when he is sentenced to such imprisonment as is mentioned in sub-section (1), the Court shall issue a warrant for his arrest for the purpose of forwarding him to the jail or other place in which he is to be confined; and in such case, the sentence shall commence on the date of his arrest.

ઉપરોક્ત જોગવાઈ વંચાણે લેતાં આરોપીને પોતાની સામે કેસ ચાલે છે તેની જાણ છે ત્યારે આરોપીની અદાલત સમક્ષ હાજર થવાની ફરજ છે. તેમની સામેના પુરાવાનો ખુલાસો કરવા પુરતી તક આપેલ હોવા છતાં આરોપી હાજર રહેલ ન હોય, તેવા સંજોગોમાં આરોપી કેસની કાર્યવાહી થી છટકવા અથવા જાણી જોઈ ને પોતે પોતાની સામેના કેસની કાર્યવાહીથી બચવા છુપાતો ફરતો હોય ત્યારે આરોપીની ગેર હાજરી પણ કેસ ચાલી શકે છે.

- (૧૭) આમ, આ કામે ફરીયાદપક્ષે ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ ની મેન્ડેટરી જોગવાઈઓનું પાલન કરી, ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૧૮(એ) અને ૧૩૮ ની જોગવાઈઓ સબબ અત્રેની અદાલતે જે અનુમાનો અવેશ વિશે અને ધારક આ ચેકનાં નાણાં વસુલ મેળવવા હકકદાર છે તે અંગેના અનુમાનો વિરુદ્ધમાં બચાવપક્ષે કોઈ ખંડનીય પુરાવો રજૂ કરેલ ન હોવાના કારણસર ફરીયાદપક્ષનો આ કેસ નિ:શંકપણે સાબીત થયેલ હોવાનું અત્રેની અદાલત માને છે. નામદાર સર્વોચ્ચ અદાલતે **આર.વિજયન વિ. બેબી અને બીજા** ના ચુકાદામા ફરીયાદીને વળતર તરીકે યોગ્ય રકમ ચુકવવાનો હુકમ કરવાની હિમાયત કરી છે તે હકિકત ધ્યાને લેતા હાલના કેસમા પણ બી.એન.એસ.એસ. ૨૦૨૩ ની કલમ-૩૯૫ અન્વયે ફરીયાદીને વળતર ચુકવી આપવાનો હુકમ કરવો અને તેમા કસુર કર્યેથી કેદની સજાનો હુકમ ફરમાવવો પણ વ્યાજબી, ન્યાયી અને ઉચિત જણાય છે. આરોપીએ આર્થિક ગુનો કરેલ છે. અત્યારના પ્રવર્તમાન સમયમાં ઘંઘાને લગતા તમામ નાણાંકીય વ્યવહારો ચેક ઉપર આધારીત છે. મોટી રકમના નાણાંની લેવડ દેવડ ચેકથી થાય છે અને આ ચેક ચલણી નોટ જેવો ક્ષતિ રહીત હોવો જોઈએ. એક વખત જો એક વ્યક્તિ બીજી વ્યક્તિ કે બેંકને ચેક આપે તો તે ચેકનું અવમુલ્યન થવું જોઈએ નહીં. ચેક પરત ફરે તો તેનો અર્થ એવો થાય કે ચેકનું અવમુલ્યન થયેલ છે અને તેની કોઈ કીમત નથી તેવું કહી શકાય અને એટલા માટે જ ચેક પરત ફર્યા અંગેની ફરીયાદમાં પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ અને બી.એન.એસ.એસ. ૨૦૨૩ ની કલમ-૪૦૧ ની

જોગવાઈનો લાભ આપવો જોઈએ નહીં. આમ ઉપર મુજબ તમામ હકીકત અને ચર્ચા જોતાં આરોપીને પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ તેમજ બી.એન.એસ.એસ. ૨૦૨૩ ની કલમ-૪૦૧ ની જોગવાઈનો લાભ આપવા પાત્ર નથી. કાયદાની જોગવાઈ તથા ચેકની રકમ ધ્યાનમાં લેતાં આરોપીને યોગ્ય સજા અને યોગ્ય દંડ થવો જોઈએ તેમ હુ માનુ છું અને ફરીયાદીને પણ પુરતો ન્યાય મળ્યો છે તેવો અહેસાશ થશે આવા સંજોગોમાં ફરીયાદવાળો ચેક આ કામના આરોપીએ ફરીયાદીને કાયદેસરના દેવા અને જવાબદારી પેટે આપ્યો છે તે હકીકત ફરીયાદપક્ષ પુરવાર કરતા હોય જેથી મુદા નં.૧ પરત્વે નો જવાબ હકારમા આપી મુદા નં. ૨ અન્વયે નીચે મુજબનો હુકમ ન્યાયના વિશાળ હિતમા જાહેર કરું છું

-:: હુકમ ::-

- (૧) આથી બી.એન.એસ.એસ. ૨૦૨૩ ની કલમ-૨૭૮(૨) અન્વયે આરોપી પરમાર મુકેશભાઈ રતિલાલ, રહે. અલવાગામ, તા. બાયડ, જી. અરવલ્લીઓને ધી નેગો. ઈ. એક્ટ-૧૮૮૧ની કલમ - ૧૩૮ નાં ગુનામાં તકસીરવાળ ઠરાવીને વર્ષ-૧ (એક) ની સાદી કેદની સજા ફરમાવવામાં આવે છે.
- (૨) બી.એન.એસ.એસ. ૨૦૨૩ ની કલમ-૩૯૫ અન્વયે આરોપીએ ફરીયાદીને વળતર તરીકે ફરીયાદમા જણાવેલ ચેકની રકમ રૂ. ૧,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા એક લાખ પુરા) આજથી માસ-૧ ની મુદતમા ચુકવી આપવા તેવો હુકમ કરવામાં આવે છે. જો આરોપી સદર વળતરની રકમ ચુકવવામા કસુર કરે તો તેઓએ વધુ ૩ માસ (ત્રણ માસ)-ની સાદી કેદની સજા ભોગવવા હુકમ કરવામા આવે છે.
- (૩) આરોપી હાજર ન હોય, આરોપી વિરુદ્ધનુ સજા વોરંટ ડી.એસ.પી.શ્રી મોડાસા-અરવલ્લી નાઓ ને બજવણી અર્થે મોકલવુ.
- (૪) આરોપી હાજર થાય ત્યારે આરોપીને આ ચુકાદાની નકલ તુરંત વિનામુલ્યે પુરી પાડવાનો હુકમ કરવામા આવે છે.

ઉપરોક્ત હુકમ આજરોજ તારીખ ૦૭ મી માહે : માર્ચ, સને : ૨૦૨૬ ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કર્યો.

બાયડ તા. ૦૭ / ૦૩ / ૨૦૨૬	(વિજય ચંદુલાલ મકવાણા) એડી. ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ બાયડ કોડ નં. જી.જે. ૦૦૯૯૭
----------------------------	--------------------------------------------------------------------------------------------